https://archive.org/details/bk661/page/n0/mode/1up

1924 -Nakalank Shastra Haarmala 3 (661)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

નકળંકશાસ્ત્ર હારમાળા નંબર ૩.

પ્રત ૨૦૦૦. આવૃતી ૨જી.

શ્રી નકળંક શાસ્ત્ર

પીર સદરદીનની બાવન બોધ સોકીયા.

અને શાહી સમરણી.

પ્રગટ કરનાર,

અલીમહમદ જાનમહમદ ચુનારા.

ઓનરરી સેક્રેટરી પબ્લીસીટી એન્ડ લીટરેચર ડીપાર્ટમેંટ,

ધી રીક્રીએશન કલબ ઇન્સ્ટીટયુટ.

કાંડી મોહલ્લા, જેલ રોડ, પેઠ નંબર ૯—મુંબઈ.

ધી રીક્રીએશન કલબ ઇન્સ્ટીટયુટ પ્રેસ ડીપાર્ટમેન્ટના ઓ. સેક્રેટરી હુસેનભાઈ શરીફ તથા અબદલા કાસમે ખોજા સીંધી પ્રીન્ટીંગ પ્રેસ પાલખી મહોલા મુંબઈ નં. ૯ માં પ્રગટ કર્તા માટે છાપી.

સને ૧૯૨૪. કીમત રૂ ૦—૦—૬.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk661/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 3, 6, 11, 14.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk661/page/n2/mode/1up

1924 -Nakalank Shastra Haarmala 3 (661)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.19 13:14:30 +05'30'

Real Patidar
Unravel Truth

સતપંથ નકલંક શાસ્ત્ર હારમાળા ૩

realpatidar.com

નકળંકશાસ્ત્ર હારમાળા નંબર ૩.

પ્રત ૨૦૦૦. આવૃતી ૨૭.

શ્રી નકળંક શાસ્ત્ર

પીર સદરદીનની બાવન બોધ સોકીયા.

અને સાહી સમરણી.

પ્રગટ કરનાર,

અલીમહુમદ જાનમહુમદ ચુનારા.
ઓનરરી સેક્રેટરી પબ્લીસીટી એન્ડ લીટરેચર ડીપાર્ટમેંટ,
ધી રીક્રીએશન કલબ ઇન્સ્ટીટયુટ.
કાંડી મોહલા, જેલ રોડ, પેરીશ નંબર ૯—મુંબઇ.

ધી રીક્રીએશન કલબ ઇન્સ્ટીટયુટ પ્રેસ ડીપાર્ટમેન્ટના
ઓ. સેક્રેટરી હુસેનભાઈ શરીફ તથા અબદુલા કાસમે
ખોજા સીંધી પ્રીન્ટીંગ પ્રેસ પાલખી મહોલા મુંબઈ
નં. ૯ માં પ્રગટ કર્તા માટે છાપી.

સને ૧૯૨૪. કીમત રૂ ૦—૦—૬.

realpatidar.com

https://archive.org/details/bk661/page/n3/mode/1up

realpatidar.com

જાહેર ખબર.

પહેરો ખાદી થાય આબાદી

સ્વાર્થ સાથે પરમાર્થ

નવ મુસ્લીમ પરમારલી બાઈઓના હાથથી વણાએલી સસ્તી અને સફાઈદાર, જુદી જુદી ડીઝાઈન ને દીલપસંદ કલરવાળી ઉમદા ખાદી પહેરી, તમારા શરીરને શણગારો, કે જેથી કોમની આબાદી થાય, અને સ્વાર્થ સાથે પરમાર્થ સાધી શકાય, હાલમાં અગાઉના કરતા ઘણા ઓછા ભાવો કર્યા છે માટે તુરતજ ઓર્ડર મોકલો.

મળવાનું ઠેકાણું :—

ધી રીક્રીએશન કલબ ઈન્સ્ટીટયુટ.

ખાંડી મહોલ્લા. જેલ રોડ, મુંબઈ—૯.

realpatidar.com

https://archive.org/details/bk661/page/n4/mode/1up

realpatidar.com

ગીનાન—પીર સદરદીનનું.

બાવન બોધ વચન અથવા મોમનની નિશાની.

સતગુર તણિ શીખામણ સાચી. ૧
સાંભળો રખીસરો. મીલી મન રાચી. ૨
દીન ઉગે તો કરો ધરમસું ધંધા. ૩
સાંજ પડે થઇ રહો સાહેબજીના બંદા. ૪
કોઈ કેની મ કરશો નીંદા. ૫
ગત માંહે આવીને કરો હેજંદા. ૬
સતગુર વચને ચીત રાખો ચંદા. ૭
રીખીસર કેરી વીરા એ છે સંજા. ૮
સંજા બાંધો મુનીવર ભાઈ. ૯
મલી કરો ગત માંહે તમે ધરમ ઉપાઈ ૧૦
મન મારો તો મમતા મુઈ. ૧૧
ધરમસરાએ આવી ન રહીએ સુઈ. ૧૨
ધરમસરાએ આવી કેની વાત ન કરીએ. ૧૩
આહાર ઘણેરો કરી પેટ ન ભરીએ. ૧૪
જો પેટ ભરશો તો ભારી થાશો. ૧૫
આવશે નીંદ્રા ને બહુ પસતાશો. ૧૬
હલવે પેટે વીરા હોંસજ થાશે. ૧૭

realpatidar.com

https://archive.org/details/bk661/page/n5/mode/1up

1924 -Nakalank Shastra Haarmala 3 (661)

realpatidar.com

જાગતા જપીએ તો સતગુર પાસે. ૧૮
વડા નાનાને અદબે રહીએ. ૧૯
વડા તણા બે અવગુણ સહીએ. ૨૦
દહાડો વડો તેને વરસ વડો કરી જાણો. ૨૧
બોલાવો ભારી મોઢે પરમાણો. ૨૨
આપણ થકી જે નાનેરો શાઈ. ૨૩
તેને કહી બોલાવો મોટેરો ભાઈ. ૨૪
મીઠે વચને બોલાવો વિરા. ૨૫
તો તમારા મોઢા માંહે ઝલકે હીરા. ૨૬
સતગુરૂ મલ્યાના એ છે ભેદ. ૨૭
રીખીસર કેનો મ કરશો ખેદ. ૨૮
આલસ નીંદ્રા ન કરીએ જાણી. ૨૯
જુઠ તજો વેદ વચન પરમાણી. ૩૦
સાંભલે રૂડો ને આચરે ભુંડો. ૩૧
તો તમે જાણો નીશ્ચે થાશે ભુંડો. ૩૨
કામ કરોધ વીરા નાંખો કાઢી. ૩૩
અમીરસ પીવો નીશાની લાવો દાડી. ૩૪
ઘેર થકી ધરમ દુઆરે આવો. ૩૫
ઉપજે લાભ નીશાની લાવો. ૩૬
સંપત હોવે તેવું લાવો. ૩૭

realpatidar.com

https://archive.org/details/bk661/page/n6/mode/1up

1924 -Nakalank Shastra Haarmala 3 (661)

realpatidar.com

મુખી સાથે ન કરીએ દાવો. ૩૮
દાવો કરે તેને દુનીઆ સોઆવે. ૩૯
આવશે દારિદ્ર ને દીન ન પાવે. ૪૦
અધરમી તે જે અણ આચારી. ૪૧
જાણી અજાણી દેખાડે પંચારી. ૪૨
સુતક ભરેઆ જે નર રહેશે. ૪૩
ઉપજે હાણ ને બહુ દુખ સહેશે. ૪૪
ધરમી ધીંગાણાની વાત ન જાણે. ૪૫
અધરમી મન માંહે ઓછું આણે. ૪૬
ધીઆન ધરી હાથે લીઓ સમરણી. ૪૭
છાની છપની કરો ઉત્તમ કરણી. ૪૮
ગીનાન ધીઆન માંહે જુવો વીમાસી. ૪૯
હાણ વીરોધ સોધો તપાસી. ૫૦
અમીરસ પીવે નીશાની લાવે દાડી. ૫૧
તેના સતગુર મેલે સરવે કષ્ટ ટાલી. ૫૨
એવે ગુણે મુનીવર ભરીઆ. ૫૩
રખીસર સાંભલો તમે સોએ કીરીઆ. ૫૪

realpatidar.com

https://archive.org/details/bk661/page/n7/mode/1up

realpatidar.com

ગીનાન–પીર સદરદીનનું.

સો ક્રિયા.

પ્રથમ હ્રદય ધોઇને નીરમલ કરીએ. ૧
બીજી ક્રીયા નાહીને જમીએ. ૨
સતે ચાલો તમે દિવસ ને રાત. ૩
કુડ કપટની મેલો ઘાત. ૪
દયા પાલો તમે દિલ સું જાણી. ૫
સુપાત્રે દાન દિજે પરમાણી. ૬
પરતક જાણીને પાસે રહીએ. ૭
સતગુર વચન રદામાંહે ગ્રહીએ. ૮
વડાઈપણાનો ગર્વ ન કરીએ. ૯
દસમી ક્રીયા કાંઈ ક્રોધ ન કરીએ. ૧૦
સરજેઆ હોય તો સતગુરને મલીએ. ૧૧
ધરમ તણું આલસ ન કરીએ. ૧૨
નીત નીત ગતમાંહે મલીએ ભાઈ. ૧૩
ગુર મુખ ગતમાહે નમો ધીઆઈ. ૧૪
નીત નીત અમી પીએ તે નર ધરમી. ૧૫
અહુંકાર મુકે તે સદા સુકરમી. ૧૬

realpatidar.com

https://archive.org/details/bk661/page/n8/mode/1up

realpatidar.com

લોભ ન કરવો એક લગાર. ૧૭
પાક દાનતે રહેવું નીરધાર. ૧૮
જુઠું રખીસરને બોલવું નહીં. ૧૯
સેવા અભીઆગતની કરવી સહી. ૨૦
ભુખીઆને ભોજન આપવું જાણી. ૨૧
તરસીઆને પણ પાવું પાણી. ૨૨
નાગાને વસ્ત્ર આપીને અર્થજ લેવું. ૨૩
સગા સાવગાની ગાસજ સેહેવું. ૨૪
સો ગાળ સાંખીને ક્રોધ ન કરવો. ૨૫
અવગુણ કરે તાસું ગુણજ કરવો. ૨૬
ઓછું કેને વીરા આલવું નહીં. ૨૭
અદકું કેનું વીરા લેવું નહીં. ૨૮
કુડી નજર કોઈ પર ન ધરીએ. ૨૯
પર સ્ત્રી સાથે ગવન ન કરીએ. ૩૦
જુઠી અજાણી ન દીજે ગવાહી. ૩૧
કુડ કપટ ન રચીએ ભાઈ. ૩૨
મુખ થકી માર ન કહીએ લગાર. ૩૩
ધન વીઆજનો ન કરીએ આહાર. ૩૪
હાડ વકરો કરવો નાહીં. ૩૫
પશુ પાલી ન વેચવું ભાઈ. ૩૬
ધરણી તણું મુલ ન કરીએ એ છે માતા. ૩૭

realpatidar.com

https://archive.org/details/bk661/page/n9/mode/1up

1924 -Nakalank Shastra Haarmala 3 (661)

realpatidar.com

કન્યા તણિ રખે દ્રવ્યજ ખાતા. ૩૮
દયા આણીને કીજે ઉપકાર. ૩૯
ચાલીસમી કીરીયા પાલવી નીરધાર. ૪૦
લાંચ ન ખાઈએ વીરા એકજ રતિ. ૪૧
જુઠો ખત ન રાખીએ સતી. ૪૨
મેદાને જાઈ પાંચ આચમન કરીએ. ૪૩
પાણી લઇને લધ્વીતજ કરીએ. ૪૪
આચમન ત્રણ કરવા સહી. ૪૫
અશુદ્ધ દેહ રાખવી નહીં. ૪૬
માટી લઇને ધોવા હાથ. ૪૭
નહીં કરે તો નહીં થાયે પાક. ૪૮
વણ ગાળ્યું ન પીવું પાણી. ૪૯
જીવ જંત ન મારીએ જાણી. ૫૦
હીંગ તમાકુ ન ખાઈએ પ્રાણી. ૫૧
પરમ ઉપવાસી રહીએ જાણી. ૫૨
ખોટયું ચાટયું કેનું ખાવું નહીં. ૫૩
ગળીઅળ વસ્ત્ર ન પહેરવું ભાઈ. ૫૪
અપવાસ વ્રતનું આળસ ન કરીએ. ૫૫
પાહાણ પાખાણની પુજા ન આચરીએ. ૫૬
એલી થાપણ ન રાખવી જાણી. ૫૭
વખત વેલા ન ચુકીએ પ્રાણિ. ૫૮

realpatidar.com

https://archive.org/details/bk661/page/n10/mode/1up

1924 -Nakalank Shastra Haarmala 3 (661)

realpatidar.com

અમળ થઇને જપીએ જાપ. ૫૯
વણુ પીરસે ખાધે માહા છે પાપ. ૬૦
લાલચ પીઆરી ન કરીએ ભાઈ. ૬૧
માતા જાણો તમે વડેરી ભોજાઈ. ૬૨
નીચી સંગતે વીરા ચાલવું નહીં. ૬૩
પાઘડી વાંકી ન બાંધીએ ભાઈ. ૬૪
અરી પરી કેની ન કરવી રૂખી. ૬૫
પાડોશીને રખે કરતા દુખી. ૬૬
વીશ્વાશઘાત કેને કરવી નહીં. ૬૭
પડી જડી વસ્તુ કેની લેવી નહીં. ૬૮
કેને જાલ ન પાડીએ જાણી. ૬૯
ઉધાર ઉછીનું ન રાખીએ પ્રાણી. ૭૦
પારકુ ધન લઈ ભાગવું નહીં. ૭૧
પુત્ર થઈને દેવું સહી. ૭૨
કેને ગાળ ન દીજે જાણી. ૭૩
મુરખાઈપણું ન રાખીએ પ્રાણી. ૭૪
ગુરનર દરશન સહુને સરખું. ૭૫
શતગુરૂ કહે તે નર નરખું. ૭૬
સાચો જુઠો ન કરીએ વાદ. ૭૭
જુવો જુગટે ન રમીએ સાધ. ૭૮
નાદ છંદ ન જોઇએ ભવાઈ. ૭૯

realpatidar.com

https://archive.org/details/bk661/page/n11/mode/1up

realpatidar.com

૧૧૭૭૯

છળ છળ ભેદે સત ખોઇએ ભાઈ. ૮૦
ખારો મોરો અન કેવો નાહી. ૮૧
વખાણવું પણ કુવખાણવું નાહી. ૮૨
પરભાતે નાહીને બહાર નીસરીએ. ૮૩
સંસાર કરતવ તે ન કરીએ. ૮૪
ખટ દરશન પુજે નહીં પામો મોખ. ૮૫
વેદ શાસ્ત્ર કહે ન કરવો દુવેખ. ૮૬
હીંડતાં ચાલતાં ખાવું નહીં. ૮૭
ચતુરાઈ ચોખાઇએ રહેવું ભાઈ. ૮૮
ઝેર ખાઈ જપલાઈ જે જીવ મરસે. ૮૯
તે આવાગમણ ફરી અવતરશે. ૯૦
જર જમીનની ઈચ્છા ન કરવી. ૯૧
સ્ત્રી આગલ ગુજ વાત ન કરવી. ૯૨
અગનને પાણી ન છાંટવું જાણી. ૯૩
નીલો ઝાડ ન વાઢીએ પ્રાણી. ૯૪
પ્રભાતે પુલ ચુંટે મહા છે પાપ. ૯૫
કેની એબ ન ઉઘાડવી આપ. ૯૬
અવાચક પ્રાણીની આળ ન કરીએ. ૯૭
ભોજન છાંડી ઉઠી ન પરહરીએ. ૯૮
સતપંથી તેજે સત ધરમ અનુસરીઆ. ૯૯
રખીસર પાળો તમે સોએ કીરીઆ. ૧૦૦

realpatidar.com

https://archive.org/details/bk661/page/n12/mode/1up

1924 -Nakalank Shastra Haarmala 3 (661)

realpatidar.com

ગીનાન—પીર સદરદીનનું.

સહિ સમરણી.

હરિ સમરણી કરીએ. ૧
અમીરસ પીને સતગુર ગુણ વરીએ. ૨
શીખામણ પુછે તેને દેવી સારી. ૩
મુનીવર તે જે કોઈ ઉત્તમ આચારી. ૪
ધરમી ધરમ તમો વોહોરો જોઈ. ૫
સો કીરીઆની તમો પહેરો જનોઈ. ૬
બ્રાહ્મણ તે જેને ગુર બ્રહ્માજી મલેઆ. ૭
તેના ભવસાગરના ફેરા ટલેઆ. ૮
બ્રાહ્મણ તે જે જાણે બ્રહ્મ ગીનાન. ૯
ગુર નર દરશન દ્રષ્ટિ સમાન. ૧૦
ગુર નર ભેટે અડસઠ તિરથ જાણુ. ૧૧
અડસઠ તિરથ ગુર ચરણ પરમાણુ ૧૨
પરતક ગુર નર ગત માંહે બેઠા. ૧૩
ભાગ્ય તેના જેણે નજરે દીઠા. ૧૪

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk661/page/n13/mode/1up

1924 -Nakalank Shastra Haarmala 3 (661)

realpatidar.com

ગીનાન ધીઆન માંહે જુવો વિચારી. ૧૫
દુનીયાં માંહે છે દેવ પ્રગટ અવતારી. ૧૬
નીરમલ થઇને ધરવો ધીઆન. ૧૭
રીખીસર તે જે જાણે ગીનાન. ૧૮
મુનીવર તે જે વારે મન. ૧૯
કરે કસોટી કાયા રતન. ૨૦
પ્રભાતે ઉઠીને પાકજ થાવું. ૨૧
એઠું પશુનું ન ખાઇએ ખાવું. ૨૨
નીરમલ થઇને જમીએ સાર. ૨૩
પાક નજરે જોવો સંસાર. ૨૪
ગતમાંહે જઇને સનમુખ રહેવું. ૨૫
ગતનું વચન શીર પર લેવું ૨૬
જેણે કલમાં નબી પર ભરેઆ ૨૭
તેણે પગલાં બેહેસત માંહે ધરેઆ ૨૮
જેણે ધીઆન સાહેબ પર ધરેઆ ૨૯
તેણે પાણી સરવે સોએ કીરીઆ ૩૦
ગીઆન ધીઆન માંહે કહ્યા છે રતન ૩૧
પીર સદરદીન બોલેઆ સત વચન ૩૨

realpatidar.com

https://archive.org/details/bk661/page/n14/mode/1up

૧૧૧૭૨૯

realpatidar.com

નીચે જણાવેલા ફોટાઓ તેની સાથે જણાવેલી કિંમતે સાફી ભાવે મળશે.

નં.	ફોટાની વિગત.	નંગ.	રૂ.	આ.	પા.
૧	આપણા હાજર ઇમામના ત્રણ રંગીનું ભભકાદાર ફોટો.	૧	૦	૨	૦
૨	આપણા હાજર ઇમામના રજપુત ડ્રેસમાં ફુલ સાઇઝ તથા હાફ સાઇઝ.	૧	૦	૧	૬
૩	આપણા હાજર ઇમામના રજપુત ડ્રેસમાં ફુલ સાઇઝ તથા હાફ સાઇઝ.	૧૦૦	૭	૦	૦
૪	પ્રીન્સ અલીશાહના ફોટા.	૧	૦	૦	૬
૫	,, ,,	૧૦૦	૨	૮	૦
૬	ત્રણ કલરમાં હાજર ઇમામના ફોટા	૧૦૦	૩	૦	૦
૭	ત્રણ કલરમાં હાજર ઇમામના ફોટા.	૧	૦	૧	૦
૮	એક કલરમાં હાજર ઇમામના ફોટો.	૧૦૦	૨	૦	૦
૯	એક કલરમાં હાજર ઇમામનો ફોટો.	૧	૦	૦	૬

ઓછામાં ઓછા ૨૫ ફોટા એકી સાથે ખરીદનારને ૧૦૦ ના ભાવે મલશે.

ધી રીક્રીએશન કલબ ઇન્સ્ટીટ્યુટ

કાંદી મહોલ્લા, જેલ રોડ, મુંબઇ—૯

realpatidar.com

https://archive.org/details/bk661/page/n15/mode/1up

realpatidar.com

નીચે જણાવેલાં પુસ્તકો, તેની સાથે જણાવેલી કીમતે સારી ભાવે મળશે.

		રૂ. આ. પા.
૧	નકળંક શાસ્ત્ર ભાગ બીજો	૨–૮–૦
૨	નકળંક જ્ઞાન પ્રકાશ	૦-૧૨-૦
૩	નકળંક ભજન સંગ્રહ	૦-૧૨-૦
૪	ખુલી ચીઠીનું બોપાળું	૦-૧૦-૦
૫	આઇતાબે હકીકત	૦–૮–૦
૬	અસલ ધુઆ (તરજુમાં સાથે)	૦–૪–૦
૭	હકીકતી ઈસ્લામી આયતો	૦–૨–૦
૮	આર્યસમાજી પંડિતોનું પોકળ	૦–૧–૬
૯	આર્યપ્રકાશની ઉદ્ધતાઈ	૦–૧–૬
૧૦	દેલમી આરાધ	૦–૧–૦
૧૧	નુરે હકીકત	૦–૧–૦
૧૨	તારીફે સુલતાન મહમદ	૦–૧–૦
૧૩	જન્મોત્સવ	૦–૧–૦
૧૪	ઇંશાઅંતે ઇસ્લામ એટલે શું?	૦–૦–૬
૧૫	ખ્રીસ્તી–ઝમ	૦–૨–૦
૧૬	નકળંક શાસ્ત્ર હારમાળા નં ૧ ... ... (પીર શમ્સની (૨૮) ગરબીઓ)	૦–૨–૦
૧૭	નકળંક શાસ્ત્ર હારમાળા નં. ૨ (પીર શમ્સનો વાયક મોટો)	૦–૦–૬
૧૮	નકળંક શાસ્ત્ર હારમાળા નં. ૩ (પીર સદરૂદીનના બાવન બોધ સાંકીયા અને સહી સમરણી)	૦–૦–૬
૧૯	ઇલાહીમત	૦–૩–૦
૨૦	કૃષ્ણવાણી	૦–૨–૦
૨૧	અથઅલોપનિષદ (શુદ્ધ ગુજરાતી ભાષાંતર) ...	૦–૨–૦

ધી રીફોર્મેશન કલબ ઈન્સ્ટીટ્યુટ,
ખાંડી મહોલ્લા જેલ રોડ મુંબઈ નં. ૯

realpatidar.com